


સવારે યા સાંજે અકિલા ન્યુઝ .કોમ

તા. ૭ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ વદ - ૬ બુધવાર



News of Wednesday, 7th March 2018

રિવર્સ ઇ ઓક્શન પદ્ધતિ ફળી: નાગરિક પુરવઠા નિગમને રૂ.૨૮.૭૧ કરોડની બચત
ચીજ વસ્તુઓના પરિવહન, ડોરસ્ટેપ ડીલીવરી અને લેબર કોન્ટ્રાક્ટમાં નવો પ્રયોગ: જયેશ રાદડિયા, સંગીતાસિંઘ, રાજેષ
પાઠકનું માર્ગદર્શન: મનીષ ભારદ્વાજને સફળતા



રાજકોટ, તા. ૭ : ગુજરાતના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ફેઠળના નાગરિક પુરવઠા નિગમ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટ, ડોર સ્ટેપ ડીલીવરી અને લેબર કોન્ટ્રાક્ટમાં પ્રથમ વખત એન. કોડ સોલ્યુશન્સ પ્લેટફોર્મથી રિવર્સ ઇ ઓક્શનનો પ્રયોગ કરાતા નિગમને ૧ વર્ષમાં રૂ. ૨૮.૭૧ કરોડ રૂપિયાની બચત થઇ છે.

વિભાગના મંત્રી શ્રી જયેશ રાદડિયા, વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંઘ (આઇ.એ.એસ) અને નિગમના ચેરમેનશ્રી રાજેષ પાઠકના માર્ગદર્શન ફેઠળ એમ.ડી.શ્રી મનીષ ભારદ્વાજે (આઇ.એ.એસ) કોન્ટ્રાક્ટરોમાં સ્પર્ધાનું તત્વ ઉમેરતા સરકારી નિગમને નોંધપાત્ર બચત થઇ છે.

શ્રી મનીષ ભારદ્વાજના જણાવ્યા મુજબ નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ દમ્યાન જિલ્લાવાર ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટસ તાલુકાના ડીએસડી કોન્ટ્રાક્ટસ અને લેબર કોન્ટ્રાક્ટસ એનાયત કરવા e-Tendering ને સ્થાને reverse-Auction પદ્ધતિની અમલવારી પ્રથમવાર જ શરૂ કરવામાં આવી. નીગમદ્વારા (n) Code Solutions સાથે reverse-Auction પદ્ધતિ ફેઠળ જિલ્લાવાર પરિવાહન ઇજારા, તાલુકા/ઝોનવાર ડોર સ્ટેપ ડીલીવરી તેમજ ગોડાઉનવાર મજૂરી કામના ઇજારા માટે SERVICE PROVIDE કરવા MoU કરવામાં આવેલ છે.

ગુજરાત ફાઇર્ફોટ દ્વારા રાજકોટ જિલ્લાના કિસ્સામાં જિલ્લા કલેક્ટરશ્રી, રાજકોટના અધ્યક્ષસ્થાને નિયત થયેલી સમિતિ દ્વારા ડોર સ્ટેપ ડીલીવરીના કોન્ટ્રાક્ટ માટેની ડોટ મેટરમાં જણાવેલ અવલોકનોને ધ્યાને લઇ નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન તાલુકાવાર ડોર સ્ટેપ ડીલીવરીના કોન્ટ્રાક્ટ પણ રાજ્ય સરકારના તા. ૨૭-૦૨-૨૦૧૨ના ઠરાવને ધ્યાને લઇ નિગમ દ્વારા કેન્દ્રીય ધોરણે reverse e-Auction પદ્ધતિથી એનાયત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે તે જ ધોરણે જિલ્લા કક્ષાએ જાહેર ટેન્ડર પ્રક્રિયા (e-tendering) થી તાલુકાવાર મજૂરી કામના ઇજારા સુપ્રત કરવાની પદ્ધતિમાં ફેરફાર કરીને કેન્દ્રીય

ધોરણે નિગમની વડી કચેરી ખાતેથી (e-Tendeing) પધ્ધતિ અમલમાં મુકીને મજુરી કામના ઇજારા સુપ્રત કરવાની કાર્યવાહી ફાથ ધરેલ છે.

શ્રી મનીષ ભારદ્વાજે જણાવેલ કે જિલ્લાવાર પરિવહન ખર્ચ ૨૦૧૭-૧૮ માં અંદાજીત રૂ. ૮૭.૭૦ કરોડ છે. તે ૨૦૧૮-૧૯ માં સંભવિત પરિવહન ખર્ચ ૭૮.૦૮ ટકા છે. વિતેલા વર્ષની સરખામણીએ ૧૧ ટકા ઘટાડો સંભવે છે. ડોર સ્ટેપ ડીલીવરી કોન્ટ્રાક્ટમાં ૨૦૧૭-૧૮ માં ૬૧.૮૨ કરોડ પરિવહન ખર્ચ થયેલ. તે ૨૦૧૮-૧૯ માં ૪૬.૫૭ ટકા થવા પાત્ર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુન-૨૦૧૭ માં ડીઝલનો ભાવ રૂ. ૫૯.૨૮/લીટરની તુલનામાં ફેબ્રુઆરી '૧૮ માસ દરમ્યાન રૂ. ૬૭.૩૧/લીટર થયેલ છે, જે મુજબ ૧૩.૫૫% વધારો થયેલ છે. મોંઘવારી સૂચક આંકમાં આ સમયગાળા દરમ્યાન ૫.૮ પોઇન્ટ એટલે કે ૨.૦૧% નો વધારો થયેલ છે.

તાલુકાના ગોડાઉન કેન્દ્ર ખાતે અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ (NFSA--૨૦૧૩માં PDS, MDM, ICDS...)ના મજુરી કામ (ચઢાઇ, ઉતરાઇ, સમભરતી...) ની ઓપરેશનલ કામગીરી માટે લેબર કોન્ટ્રાક્ટ પણ શરૂઆતથી અને Manual System ૨૦૦૩-૦૪ થી e-Tendering System થી એનાયત કરવામાં આવતાં ફતા પરંતુ નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૨૦૭ તાલુકા ગોડાઉન કેન્દ્રો ખાતે પ્રથમ વખત reverse e-Auction થી લેબર કોન્ટ્રાક્ટ એનાયત કરવાની કામગીરી પણ ફાલ ચાલુમાં છે (૦૫ માર્ચ ૨૦૧૮ના ૧૫.૦૦ કલાકની સ્થિતિએ ૨૦૭ તાલુકા ગોડાઉન કેન્દ્ર પૈકી ૧૩૬ તાલુકા ગોડાઉન કેન્દ્રોના થયેલ reverse e-Auctionમાં કુલ રૂ. ૩૮૪.૨૭ લાખનો ઘટાડો/બચત થયેલ છે. બાકીના તાલુકા ગોડાઉનો માટે Reverse e.Auction ની કામગીરી ચાલુમાં છે જે ૮ માર્ચ '૧૮ સુધી ચાલશે. એકંદરે રિવર્સ ઇ ઓક્શનના પ્રયોગ દ્વારા અત્યાર સુધી રૂ. ૨૮.૭૧ કરોડની બચત થવા પામેલ છે.

(3:59 pm IST)